

B.Ed. Semester - 2 (CBCS) Examination
May/June-2022 (NEW COURSE)
Accountancy Content (GROUP A CONTENT-1)

Time: 1:15 Hours

Marks: 35

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧ નીચેના પ્રત્યેક પ્રશ્નનો ટૂંકમાં ઉત્તર આપો.

૦૫

- ૧.૧ વિસરચૂક ભૂલ એટલે શું?
- ૧.૨ ઘસારો એટલે શું?
- ૧.૩ જોગવાઈના લક્ષણો જણાવો.
- ૧.૪ નાણાકીય પત્રકોના ઉદ્દેશો જણાવો.
- ૧.૫ બેઠોમેળ એટલે શું?

પ્રશ્ન.૨ નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ ૫ પ્રશ્નોના ઉત્તર આપો.(૬ માંથી ૫)

૧૦

- ૨.૧ ઉપલક ખાતું એટલે શું?
- ૨.૨ ઘસારાના લક્ષણો જણાવો.
- ૨.૩ અનામત એટલે શું?
- ૨.૪ નાણાકીય પત્રકોનું મહત્ત્વ સ્પષ્ટ કરો.
- ૨.૫ આવરો એટલે શું?
- ૨.૬ નામા માટે તૈયાર ઉપલબ્ધ સોફ્ટવેરના નામ આપો.

પ્રશ્ન.૩ નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ ૫ પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો.(૬ માંથી ૫)

૨૦

- ૩.૧ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો સમજાવો.
- ૩.૨ ઘસારાની ઘટતી જતી બાકીની પદ્ધતિ ઉદાહરણ સાથે સમજાવો.
- ૩.૩ સામાન્ય અનામત અને જોગવાઈ વચ્ચે તફાવતના ચાર મુદ્દા સ્પષ્ટ કરો.
- ૩.૪ નફાનુકસાન ખાતાનો નમૂનો આપો.
- ૩.૫ દેશી નામાપદ્ધતિના લક્ષણો સ્પષ્ટ કરો.
- ૩.૬ કમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગો સ્પષ્ટ કરો.

English Version

- Q.1 Answer each of the following in brief. 05**
- 1.1 What is error of omission?
 - 1.2 What is depreciation?
 - 1.3 List characteristics of provision?
 - 1.4 state objectives of financial statements?
 - 1.5 What is “Bethome”?
- Q.2 Answer any 5 from the following 6.(5 out of 6) 10**
- 2.1 What is suspense account?
 - 2.2 List characteristics of depreciation.
 - 2.3 What is reserve.
 - 2.4 Mention the importance of financial statements.
 - 2.5 What is “Aavaro”?
 - 2.6 Name readymade software for accounting.
- Q.3 Answer any 5 from following 6 in detail.(5 out of 6) 20**
- 3.1 Explain errors that do not affect the trail balance.
 - 3.2 Explain reducing balance method of depreciation with example.
 - 3.3 Explain four point of difference between general reserve and provision.
 - 3.4 Give specimen of profit and loss account.
 - 3.5 Explain characteristics of Deshi Nama System.
 - 3.6 Explain components of computer accounting.
